

17 મે 2018

ઉનાળો હાથ વેંતમાં છે અને તમારા શહેરમાં તેને માણવાની ઘણી બધી રીતો છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો – આ ઉનાળો બ્રેમ્પટન માટે એક રોમાંચક પ્રસંગોથી ભરેલી સિઝન થવા જઈ રહી છે જેમાં તેહેવારો હશે, બજારો ભરાશે અને પોતાના સમુદાયમાં શહેરીજનો બહારની પ્રવૃત્તિઓને માણશે.

શનિવારે બધું બાજુ પર મુકીને તે જૂન 9 ના રોજ સવારે 11 થી સાંજે 9 સુધી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં સેલેબ્રેમ્પટન (CeleBrampton) આવી રહ્યું છે જે બે વખત ટોપ 100 ફેસ્ટિવલ એન્ડ ઇવેન્ટ એવોર્ડ, ઓન્ટારિયોમાં વિજેતા રહી ચૂક્યું છે. આ વાર્ષિક એક દિવસીય સમુદાયિક ઉજવણી બ્રેમ્પટનની ખુલ્લી, મિત્રતાપૂર્ણ, વૈવિધ્ય ધરાવતા સમુદાયના દર્શન કરાવે છે અને નાગરિકોને સીટીની પહેલો અને સેવાઓ વિષે જાણકારી મેળવવાની તક પૂરી પાડે છે. તે સીટીની સંસ્કૃતિ, વારસા, કલા, નૃત્ય અને ફુડ પર પારિવારિક ગમ્મત અને વિવિધ સ્થાનિક મનોરંજનના કાર્યક્રમોની મદદથી પ્રકાશ ફેંકશે.

તેના પોઅઈના શનિવારે જૂન 16ના રોજ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ડાઉનટાઉન ફાર્મર્સ માર્કેટ વહેલી સવારે 7 વાગ્યે મેઈન સ્ટ્રીટ પર ખુલશે. માર્કેટના મુલાકાતીઓને દર શનિવારે બપોરે 1 વગ્યા સુધી ખેડુતો, કલાકારો અને નટોની મુલાકાત લેવાનો સમય મળશે અને ત્યાં વાડીએથી આવેલા તાજા ઉત્પાદો અને હાથકળાની વસ્તુઓ ખરીદી શકશે.

તે જ દિવસે મોડેથી, ગાર્ડન સ્ક્વેર પર સેટરડે નાઈટ મૂવિઝ ઈન ગાર્ડન સ્ક્વેરનો (Saturday Night Movies in Garden Square) લોન્ચ નીહાળવા માટે પ્રયાણ કરશો. સાથે ખુરશી લાવશો અને સાંજે 7 થી સાંજે 9 સુધી શોઝ માણશો.

ગુરુવાર, જૂન 21ના દિને માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ માર્કેટ (Mount Pleasant Village Market)ની નવશરૂઆત થશે. આ પાડોશની માર્કેટ ગામના હાઈમાં છેલ્લા ઘણાં વર્ષોથી એકધારી વિકાસ પામી રહી છે. જ્યાં ખેડુતો અને ફેરિયા અનન્ય આઈટમો વેચતા હોય છે અને ગુરુવારની સાંજ વિતાવવા માટેની આ એક જોરદાર રીત બની રહેશે. માર્કેટ થેક્સગિવિંગ સપ્તાહ સુધી સાંજે 4 થી 8 સુધી ચાલશે.

તમારા કેલેન્ડરોમાં કેનેડા ડેની ઉજવણી નોંધવાનું ભૂલશો નહીં જે ચિંગાકુસી પાર્કમાં હાથ ધરાશે જ્યાં આપણે સહુ એક સમુદાય તરીકે જુલાઈ 1ના દિને આપણા રાષ્ટ્રને વધાવીશું. પાર્કમાં બીજું પણ ઘણું બધું હશે અને તે ચુકી ના જતાં જેમાં કમ્યુનિટી આર્ટ એક્ટિવેશન, વિવિધ ફૂડની શ્રેણી, જોરદાર સંગીતનું મનોરંજન અને રાત્રે 10 વાગ્યે આતશબાજી તો ખરી જ.

જુલાઈ 2થી શરૂ કરીને સપ્તાહના કોઈ પણ દિવસે ગાર્ડન સ્ક્વેર જશો એટલે મસ્ત સમર વાઈબ્સ આત્મસાત કરી શકશો. ગાર્ડન સ્ક્વેર પ્રવૃત્તિઓમાં સમાવેશ થશે અમારી સહુ પ્રથમ વખત થનાર પ્રાઈડ સેલેબ્રેશન (Pride celebration), સૌની પ્રિય ઈસ્ટ કોસ્ટ કિચન પાર્ટી (East Coast Kitchen Party) અને લોકપ્રિય સ્ટોમ્પ એન સ્ટેમ્પિડ (Stomp 'N' Stampede) સાપ્તાહિક રજૂઆતોમાં સામેલ હશે યુટ્યુબ (YouTube)ના કલાકારો, ઊભરતી સ્થાનિક પ્રતિભાઓ અને બોલીવુડ ફિલ્મ નાઈટ.

ધ રોજ શરૂ કરશે સમૃદ્ધ વૈવિધ્ય ધરાવતી 2018-2019 સિઝન જેમાં હશે સમર થિએટર સિરિઝ જે ચાલશે જુલાઈ 24 – સપ્ટેમ્બર 7 સુધી. નોર્થ અમેરિકનની સૌથી વિશાળ ભાંગડા સ્પર્ધા માણશો જે ફ્લાવર સીટી ભાંગડાની ભાગીદારીમાં થશે, ઓગસ્ટ 4 અને સપ્ટેમ્બરના પૂર્વાર્ધમાં વર્લ્ડ ઓફ જાઝ ફેસ્ટિવલ (World of Jazz Festival)માં આનંદ માણશો જે સ્થાનિક સંસ્થા B-Jazzedની ભાગીદારીમાં રજૂ થશે.

આવા અને આવા ઘણા બધાં પ્રસંગો અને પ્રવૃત્તિઓ તમને સીટી ઓફ બ્રમ્પટનની [2018 વિઝિટર ગાઈડ](http://www.brampton.ca/events) માં અથવા www.brampton.ca/eventsમાં મળી જશે.

ક્વોટ:

"ઉનાળો એક એવો સમય છે જ્યારે આપણો સમુદાય સાથે મળીને આ સુંદર શહેરને ખૂંદે છે, જેને આપણે આપણું ઘર કહીએ છીએ, એવા સમયે માણો નિ:શુલ્ક, ગમ્મતથી ભરપૂર પ્રવૃત્તિઓનો આનંદ અને અન્ય બ્રેમ્પટનવાસીઓ સાથે સંબંધો બાંધવાની તક મેળવો. આ ઉનાળે બ્રેમ્પટનમાં થનાર ઉજવણીઓ અને હાટો અને તહેવારોમાં અમે આપ સહુને જોવા આતુર છીએ."

- મેયર લિન્ડા જેફી

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.